

NOTE: All Questions carry equal marks.

નોંધ: બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.

નીચેનામાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપો.

૧૪*૩=૪૨

પ્ર. ૧: ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં અજંતાની ચિત્રકલાનું વર્ણન કરો.

પ્ર. ૨: બાઘના ગુફાચિત્રો વિશે નોંધ લખો.

પ્ર. ૩: બાદામી અને સિત્તનવાસનની ચિત્રકલાનું મૂલ્યાંકન કરો.

પ્ર. ૪: પશ્ચિમ ભારતની લઘુ ચિત્રશૈલીના લક્ષણો સમજાવો.

પ્ર. ૫: ભારતીય ચિત્રકલાના વિકાસમાં જહાંગીરનું પ્રદાન વર્ણવો.

પ્ર. ૬: રાજસ્થાની ચિત્રોના વિષયો વિશે વિસ્તૃત અહેવાલ આપો.

પ્ર. ૭: પહાડી ચિત્રશૈલીના કેન્દ્રોની ચર્ચા કરો.

પ્ર. ૮: આધુનિક ચિત્રકલાના વિષય વૈવિધ્યનો પરિચય કરવો.

પ્ર. ૯: નીચેનામાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

૨*૪=૦૮

(૧) અજંતાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે?

(૨) બાઘની ગુફાનો સમયગાળો જણાવો.

(૩) મુઘલ ચિત્રકલા કઈ બે કલાઓનો સમન્વય છે?

(૪) મુઘલ ચિત્રકલાના વિષયો જણાવો.

(૫) સિત્તનવાસનના ગુફાચિત્રો ક્યા ધર્મથી પ્રેરિત છે?

(૬) જહાંગીર દરબારના પ્રસિદ્ધ ચિત્રકારોના નામ આપો.

(૭) રાજસ્થાની ચિત્રકલાના કેન્દ્રો જણાવો.

(૮) ગુજરાત કલાસંઘના સ્થાપક કોણ હતા?

861-2
M.A SEM -IV

JULY-2021

SUB: INDIAN CULTURE (INDOLOGY)
INCL-510 STUDIES IN INDIAN PAINTING-II

TOTAL MARKS: 50

NOTE: All Questions carry equal marks.

WRITE THE ANSWER IN DETAIL. (ANY THREE) 14*3=42

- Q. 1: Describe the painting of Ajanta in the history of Indian Painting.
- Q. 2: Write a note about Bagh Cave Paintings.
- Q. 3: Evaluate the paintings of Badami and Sittanavasan.
- Q. 4: Explain the features of miniature painting style of Western India.
- Q. 5: Describe the Jahangir's contribution to the development of Indian painting.
- Q. 6: Give a detailed report on the subjects of Rajasthani paintings.
- Q. 7: Discuss the centers of Pahari Painting style.
- Q. 8: Introducing the subject variations of Modern Painting.

Q. 9: ANSWER IN BRIEF (ANY FOUR) 2*4=08

- (1) In which state are the caves of Ajanta located?
- (2) State the duration of the Bagh Cave.
- (3) Mughal painting style was a combination of which two painting style?
- (4) Give the subjects of Mughal painting.
- (5) The cave paintings of Sittanavasal are inspired by which religion?
- (6) Give the name of famous painters of Jahangir Darbar.
- (7) Give the name of centers of Rajastani Painting Style.
- (8) Who was the founder of Gujarat Kala Sangh?
-